

ત્વરિત જાહેરાત માટે

આ સપ્ટેમ્બરમાં બ્રેમ્પટન વૃક્ષ માસની ઉજવણી!

બ્રેમ્પટન, ઓન્ટારિયો (27 ઓગસ્ટ 2021) – સપ્ટેમ્બર માસમાં સીટી ઓફ બ્રેમ્પટનમાં આપણા સહુ પ્રથમ વખત નિયુક્ત થયેલ વૃક્ષ માસના બ્રેમ્પટનના વૃક્ષોના વધામણી ઉન્સવમાં જોડાઓ. સિટી અને તેના ભાગીદારો ઈવેન્ટ્સ અને પહેલો યોજાશે જેમમાં આ મહત્વના મહિનાના ભાગરૂપે રોમાંચક વૃક્ષ ભેટ (Tree Giveaway)નો સમાવેશ થાય છે. બ્રેમ્પટન ટ્રી મન્યના પ્રાયોજક CN છે.

રેસિડેન્શ્યલ ટ્રી ગીવઅવે (ખુલે છે 10 સપ્ટેમ્બર 2021)

રેસિડેન્શ્યલ ટ્રી ગીવઅવેનું બ્રેમ્પટન નિવાસીઓ માટેનું રજિસ્ટ્રેશન સપ્ટેમ્બરની 10મીથી શરૂ થશે! રજિસ્ટર કરનારાઓને સિટી 2,400 વૃક્ષો વિતરિત કરશે જેમાં ભાત ભાતની જાતો હશે (રેડ મેપલ, રેડ ઓક, બર ઓક, અને વ્હાઈટ સ્પ્રુસ). વૃક્ષો એક ઘર દીઠ એક સુધી મર્યાદિત છે અને તે ફક્ત ખાનગી મિલકત પર જ વાવી શકાશે (આગળ કે પાછળના આંગણમાં). સહભાગી થવા માટે નિવાસીઓએ રજિસ્ટર કરાવવાનું રહેશે. રૂબરૂ પિક અપ કરવા માટે વૃક્ષો સપ્ટેમ્બરની 25મીના સપ્તાહના અંતથી ઉપલબ્ધ રહેશે. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca/trees.

અમારી સાથે સોશ્યલ મિડિયા પર સંપર્ક સાધો

તમારા મનગમતા વૃક્ષોના અથવા બ્રેમ્પટનના વૃક્ષોના ફોટા પાડો અને સોશ્યલ મિડિયા પર #BramptonTrees હેશટેગ વાપરીને શેર કરશો તો અમારી ચેનલો @CityBrampton પર અને વેબસાઈટ www.brampton.ca/trees પર દેખાવાનો મોકો મળી શકે છે.

કુદરતી ધરોહર પ્રણાલિ સર્વેક્ષણ (Natural Heritage Systems Survey)

બ્રેમ્પટનના વૂડલેન્ડ્સ, વેટલેન્ડ્સ, વેલીલેન્ડ્સ, ઘાસના મેદાનો, અન્ય કુદરતી જગ્યાઓ વિશે તમે શું વિચારો છો તે અંગે અમને જાણાવો અને ઈનામ જીતવા માટે અમને કહો કે બ્રેમ્પટનમાં કુદરતને માણવા માટે તમે ક્યાં જાવ છો.

આ સર્વે પત્રક ભરો [કુદરતી ધરોહર પ્રણાલિ સર્વેક્ષણ \(Natural Heritage System Survey\)](http://www.brampton.ca/natural-heritage).

વૃક્ષોના સ્ત્રોતો

વૃક્ષો વિશે બધું જ જાણો અને ટ્રી મન્યમાં આ હાથવગા વૃક્ષોના સ્ત્રોતો કે સંસાધનોનો ઉપયોગ કરીને સહભાગી થાઓ!

- [બ્રેમ્પટનના વૃક્ષો \(Brampton Trees\)](#)
- [સીટી ઓફ બ્રેમ્પટનના વૃક્ષ કાળજી સૂચનો](#)
- [ઈન્ટરએક્ટિવ ટ્રી ટ્રેકિંગ ટૂલ](#)

- દસ લાખ વૃક્ષોનો કાર્યક્રમ ([One Million Trees Program](#)):
- ટ્રી કેનેડા ([Tree Canada](#))
- રાષ્ટ્રીય અરણ્ય સપ્તાહ ([National Forest Week](#)): સપ્ટેમ્બર 19 થી 25, 2021

બ્રેમ્પટન વૃક્ષ તથ્યો

- બ્રેમ્પટનમાં હાલમાં આશરે 3.6 મિલિયન એટલેકે છત્રીસ લાખ વૃક્ષો છે જે કુલ અવરાયેલ ભૂમિના 18 ટકા થાય છે.
- છેલ્લા પાંચ વર્ષમાં, સિટી અને – સંરક્ષણ અધિકારીઓ, રિજન ઓફ પીલ, શાળા મંડળો અને વિકાસશીલ ઉદ્યોગો સહિત તેમના ભાગિદારોએ – બ્રેમ્પટનમાં પ્રત્યેક વર્ષે સરેરાશ 43,000 વૃક્ષો વાવ્યા છે.
- 2014 થી અત્યાર સુધીમાં અઢી લાખ કરતા વધુ વૃક્ષો વાવવામાં આવી ચુક્યા છે.

સુવાક્યો

"બ્રેમ્પટન સીટી કાઉન્સિલે સપ્ટેમ્બરને બ્રેમ્પટન ટ્રી મન્થ તરીકે ઘોષીત કર્યો છે! બ્રેમ્પટન એક હરિત શહેર છે અને અમે આપણા શહેરના શહેરી અરણ્યને સુરક્ષિત રાખવા માટે સક્રિય રીતે કાર્ય કરી રહ્યા છીએ અને 2040 સુધીમાં દસ લાખ વૃક્ષો વાવીશું. વૃક્ષો બધાને અનેક લાભ પ્રદાન કરે છે જેમાં સામેલ છે ચોખ્ખી હવા, વાતાવરણના ફેરફારની અસરમાં ઘટાડો, મિલકતના મૂલ્યો વધવા અને આપણા સમુદાયને વધુ સુંદરતા બક્ષવી.

- પેટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

"ટ્રી મન્થની હાર્દિક શુભેચ્છાઓ, બ્રેમ્પટન! આ પ્રભાવી માસના ભાગરૂપે હું બધાને બ્રેમ્પટનની કુદરતી ધરોહર પ્રાણાલિને પિછાણવા માટે વોક લેવા, વૃક્ષ વાવવા અને આપણા ટ્રી ટ્રેકિંગ ટૂલની મદદથી તેની દેખરેખ રાખવા પ્રોત્સાહિત કરું છું તેમજ વધુ ટકાઉ વન વ્યવસ્થાપન વિશે વધુ જાણકારી મેળવવા માટે અહીં જુઓ www.brampton.ca/trees."

- રોવેના સાન્તોસ, રીજનલ કાઉન્સિલર, વોર્ડ 1 અને 5; પ્રમુખ, કમ્યુનિટી સર્વિસિસ, સિટી ઓફ બ્રેમ્પટનના પ્રમુખ

"બ્રેમ્પટન ટ્રી મન્થ તમામ લોકો માટે એવી તક છે જ્યારે તેઓ આપણા શહેરમાં વૃક્ષોની મહત્તા અને તેની કદર કેમ કરવી તે અંગે જાણકારી મેળવશે. રેસિડેન્શ્યલ ટ્રી ગીવઅવેમાં ભાગ લો, #BramptonTrees વાપરીને ફોટા પોસ્ટ કરો અને આપણા સંસાધનો અને પહેલો વિશે જાણકારી લો."

- શેરમેન વિલિયમ્સ (**Charmaine Williams**) સિટી કાઉન્સિલર વોર્ડ 7 અને 8, ઉપ-પ્રમુખ, કમ્યુનિટી સર્વિસિસ, સીટી ઓફ બ્રેમ્પટન

"સિટીના કર્મચારીઓ બ્રેમ્પટનના સુંદર વૃક્ષ છત્રની સુરક્ષા, વાવણી અને જાળવણી માટે સમર્પિત છે. બ્રેમ્પટન ટ્રી મન્થ આપણા ગ્રો ગ્રીન એનવાયર્મેન્ટલ માસ્ટર પ્લાન, અર્બન ફોરેસ્ટ મેનેજમેન્ટ પ્લાન અને કમ્યુનિટી એનર્જી તેમજ એમિશન રિડક્શન પ્રોગ્રામનું સમર્થન કરે છે."

- ડેવિડ બાર્રિક, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (David Barrick, Chief Administrative Officer), સિટી ઓફ બ્રમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 7,00,000 કરતા વધુ લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca